


વિભાગ A

(28)

સુમના પુસ્તક કો (હોર-એ 1 ગુણ, પ્રશ્ન 84 1 થી 28)

પ્રથમ વિભાગ પાસે કરો (પ્રશ્ન 84 1 થી 6)

1.



= _____ (છાપાડી એક ભાગને માનવામાં રાખી જવાબ આપો.)

(A) $\frac{4}{9}$

(B) $\frac{5}{9}$

(C) $\frac{2}{9}$

(D) $\frac{1}{9}$

2. મહત્તમ અને લઘુત્તમ અવલોકનોના તફાવતને અવલોકનોનો શું કહેવાય ?

(A) વિસ્તાર

(B) મધ્ય

(C) મધ્યસ્થ

(D) અક્ષ

3. નીચે પૈકી કયું સમીકરણ નથી ?

(A) $2x + 1 = 5$

(B) $7x = 3$

(C) $3x + 1 < 4$

(D) $x = 4$

4. એક ત્રિકોણમાં વલુમાં વલુ કેટલા ગુણોએ ચોટી શકે ?

(A) 0

(B) 1

(C) 2

(D) 3

5. નીચેના પૈકી કયો ગુણોત્તર 1 : 4 નો સમાન ગુણોત્તર નથી ?

(A) $\frac{5}{20}$

(B) $\frac{6}{16}$

(C) $\frac{1}{12}$

(D) $\frac{3}{15}$

6. એ એકરૂપ ખુલાઓ પૈકી એક ખુલાનું માપ 120° છે. તો બીજા ખુલાનું માપ કેટલું થાય ?

(A) 60°

(B) 100°

(C) 120°

(D) 30°

ખાલી જગ્યા પૂરો (પ્રશ્ન 84 7 થી 12)

7. પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યસ્થ 3 થાય.8. $5x + 1 = 6$ સોલ તો $x =$ 1 થાય.9. $\triangle ABC$ માં \overline{AD} મધ્યગા છે. તો બિંદુ D એ રેખાખંડ \overline{BC} નું મધ્યબિંદુ છે.10. મનિષને એક ક્લોટીના 50 પ્રશ્નોમાંથી 10 પ્રશ્નો ખોટા પડે છે. તો તેને જી % પ્રશ્નો સાચા પડ્યા હોય.11. 10 માંથી 1 એટલે 10 %12. $\triangle ABC$ અને $\triangle XYZ$ વચ્ચેની સંજ્ઞાતા $ABC \rightarrow YZX$ માટે B ને સંજ્ઞા Z થાય.

ગણિત - હોરસ-7 - વે. 1

• પાંચ ખોલાં સાંભળી. (પાન 13 થી 17)

| A | | B | |
|-----|-----------------------------|-----|------|
| 13. | $12 \times (-4)$ | (a) | 12 |
| 14. | 0.25×100 | (b) | 35 |
| 15. | $\frac{3}{4} = 3$ નો ઉલ્લેખ | (c) | 0.1 |
| 16. | 100 ના 15% | (d) | 1-45 |
| 17. | 10% નું વ્યાજ મૂકવું | (e) | 25 |

• ચિત્રના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. (પાન 18 થી 25)

- વિધાન પૂર્ણાંક સંખ્યાનો 1 વાળો ગુણકને કોઈ પદિતમ તેની તે જ સંખ્યા બને ✓
- $\frac{7}{9}$ ને $\frac{5}{7}$ કરતા મોટી છે. ✓
- $n = 5$ હોય તો $7n + 1 = 36$ થાય ✓
- પુસ્તકોની જોડના બુક સંખ્યા સરખા માપન હોય. ✗
- બે આલ-આલ પુસ્તકો તો તે રેલિંગ જોડ રહે. ✓
- ત્રિકોણની ખાજુના માપ 3 સેમી, 4 સેમી અને 5 સેમી હોય તો તે દરિયા ભુજિત દરિયા છે. ✓

• એક વાક્યમાં જવાબ આપો. (પાન 24 થી 28)



- પૂર્ણાંક સંખ્યાની એક જોડી લખો, જેનો સરવાળો (-5) થાય. $\text{Ans: } (-4) + (-1) = (-5)$
- કઈ સંખ્યા મોટી છે? 0.5 કે $0.05 \Rightarrow 0.5$
- એક ત્રિકોણને ઉત્કરણનો એક મજબૂત સંભાવના કેટલી છે? 2 - કારણકે
- રેલિંગ જોડ રચના બે બુકોના માપનો સરવાળો કેટલો થાય? 180°
- $\square ABCF$ માં \overline{AB} અને \overline{BC} વચ્ચે કયો ખૂણો આવેલો છે? (L) ABC

વિભાગ B

• મૂળના મુજબ જવાબ આપો. (પાન 29 થી 39, કોઈ પ્રશ્નના 2 મુજબ)

(22)

29. સંખ્યાલેખની મદદથી ગુણકર કરો. $3 \times 4 \Rightarrow 12$

30. માનકાવડ અને વડેરા રામોનું સરેરાશ 100 કિ.મી. છે. જો એક માસે 50 કિ.મી.ના અંતરે ગયા હોય તો બીજા માસે 120 કિ.મી. વડેરાની તરફે તો તે માનકાવડ કેટલા કિ.મી. પહોંચશે?

સમજાવો: $\frac{\text{સરેરાશ}}{\text{સમય}}$

$50 = \frac{100}{t}$

$t = \frac{100}{50}$

$t = 2$ - કારણકે

$1:30 + 2:00 \Rightarrow 3:30$ કારણકે સરેરાશ પહોંચશે

31. એક સોટી રીલા 1 કલાકમાં 42.5 કિલોમીટર અંતર કાપે છે. તો 4 કલાકમાં કેટલું અંતર કાપે?

$\frac{\text{સરેરાશ}}{1} \rightarrow 42.5 \text{ km}$
 $4 \rightarrow (?)$

$= 4 \times 42.5$

$= 4 \times 42.5$

$= \frac{170}{10} \text{ km અંતર કાપે}$

સરેરાશ $\frac{\text{સરેરાશ}}{\text{સમય}} = \frac{42.5}{1}$

કારણકે $\frac{42.5}{1} = \frac{170}{4}$

$m \cdot \frac{42.5}{1} = \frac{170}{4} = 5 \times 42.5$

- એક વાણી જવા માટે (૫૪ અને ૧૨ થી ૧૩)
- 12. ૪૭૦૪ થી ૪૭૦૦ સુધી સંખ્યા જણાવો 49100 થી - 19
- 13. 70 ને ૩ થી બહુવિધ ગુણક શોધવા સારામાં સારું નીચે
- 14. એક કાચા 18 થી વિભાજ્ય છે, તો તે કયા કય-કય સંખ્યા થી વિભાજ્ય છે? 3, 5
- 15. 20 થી નાનાં સંખ્યાઓ લખો 1, 2, 4, 5, 10, 20
- 16. એક કોષ્ટકની બે પાસાંઓ સમકોણીય છે.

$2P = 6 \times 4 \Rightarrow 2P = 24$
 $P = \frac{24}{2}$
 $P = 12$

$2P = 100 - 10$
 $2P = 90$
 $P = \frac{90}{2}$
 $P = 45$


13. સરેરાશ ગુણ $\frac{P}{2} = 12$ સરેરાશ ગુણ $\frac{100 + P}{2} = 100$

14. નીચેની આકૃતિમાં બતાવેલ પાસાંઓ જણાવો.




- (1) અનુરૂપાંગો કયાં કયાં છે તે જણાવો. $\angle x$ અને $\angle z$, $\angle y$ અને $\angle w$
 (2) અનુરૂપાંગોની કોઈ એક જોડ જણાવો. $\angle x$ અને $\angle z$ અથવા $\angle y$ અને $\angle w$

16. નીચેની આકૃતિમાં \angle અને 100° સંબંધમાં કયું કોણ છે તે જણાવો.





$126^\circ + x = 180^\circ$
 અથવા $126^\circ + x = 180^\circ$
 એમાં કે સમીકરણને x માટે ઉકેલવામાં આવે છે.
 $x = 180^\circ - 126^\circ$
 $x = 54^\circ$

17. ΔPQR એક સમકોણીય ત્રિકોણ છે.



ΔPQR - કોણોની શોધો.
 $m\angle P + m\angle Q + m\angle R = 180^\circ$
 $m\angle P + 90^\circ + 30^\circ = 180^\circ$
 $m\angle P = 180^\circ - 120^\circ$
 $m\angle P = 60^\circ$

18. નીચેની આકૃતિમાં પાસાંઓની સંબંધમાં કોણો કયાં કયાં છે તે જણાવો.



સરખામી કોણો માટે સંબંધો:
 $\angle A \leftrightarrow \angle P$
 $\angle B \leftrightarrow \angle Q$
 $\angle C \leftrightarrow \angle R$
 $\Delta ABC \cong \Delta PQR$

19. નીચેની આકૃતિમાં કોણોની માત્રા શોધવામાં આવે તે જણાવો.




$\frac{14}{5} = \frac{1}{2} = 50\%$

વિભાગ C

• સુવેના મુજબ જવાબ આપો. (પ્રશ્ન 40 થી 45, એક પ્રશ્નના બે ભાગો) (10)


40. એક સિમેન્ટ કંપનીને સરકાર સીમેન્ટની એક મુજબ વરોચલા થી 30 કીમી દુર છે. અને સુવેનાની ઘરેણી એક મુજબ વરોચલા થી 5 કીમી દુર છે. તો 3000 મુજબ સરકાર સીમેન્ટ અને 5000 મુજબ સુવેનાની ઘરેણી સીમેન્ટની મુજબ વરોચલા થી કેટલાં કીમી દુર છે?

41. દિનેશ સ્થળ A પરથી B પર જાય છે અને સ્થળો C પર જાય છે. A નું અંતર B થી 7.5 કીમી છે. B થી C નું અંતર 12.7 કીમી છે. અનુભવ સ્થળ A થી સ્થળ C પર જાય છે અને સ્થળો B થી C પર જાય છે. D નું અંતર A થી 9.3 કીમી છે. અને C થી D નું અંતર 11.8 કીમી છે. તો કોણ વળ મૂકવાની જગ્યા? કેટલી?



43. આપેલ આકાર જુઓ. (આ આકાર 11 ની જેવો છે)
 12. આપેલ આકાર જુઓ અને તેનો કોણ (x) ની કિંમત શોધો.
 આ આકાર 11 ની જેવો છે. તેનો કોણ (x) ની કિંમત શોધો.

- 43. આપેલ આકાર જુઓ અને તેનો કોણ (x) ની કિંમત શોધો.
- 44. આપેલ આકાર જુઓ અને તેનો કોણ (x) ની કિંમત શોધો.



44. આપેલ આકાર જુઓ અને તેનો કોણ (x) ની કિંમત શોધો. આ આકાર 11 ની જેવો છે.



45. આપેલ આકાર જુઓ અને તેનો કોણ (x) ની કિંમત શોધો. આ આકાર 11 ની જેવો છે.

$P = 21, m \angle B = 95$
 $Q = 51$
 $R = 210 - 95 - 51$
 $R = 154$
 $T = 180 - 154$
 $T = 26$
 $2x = 26$
 $x = 13$
13
 Answer


વિભાગ D

46. આ આકાર જુઓ અને તેનો કોણ (x) ની કિંમત શોધો. (આ આકાર 11 ની જેવો છે.) (12)

આ આકાર જુઓ અને તેનો કોણ (x) ની કિંમત શોધો. આ આકાર 11 ની જેવો છે.

| કોણ | કોણ | કોણ | કોણ | કોણ | કોણ |
|-------|-----|-------|-----|-------|-----|
| કોણ A | 120 | કોણ B | 100 | કોણ C | 110 |
| કોણ D | 90 | કોણ E | 80 | | |

47. આ આકાર જુઓ અને તેનો કોણ (x) ની કિંમત શોધો.



$m \angle A = 30$
 $m \angle B = 40$
 $m \angle C = 50$

48. આ આકાર જુઓ અને તેનો કોણ (x) ની કિંમત શોધો.

આ આકાર જુઓ અને તેનો કોણ (x) ની કિંમત શોધો. આ આકાર 11 ની જેવો છે.

$m \angle A = 100, m \angle C = 180$
 $3x + 4x + 5x = 180$
 $12x = 180$
 $x = 15$
15

$m \angle A = 3x = 3 \times 15 = 45$
 $m \angle B = 4x = 4 \times 15 = 60$
 $m \angle C = 5x = 5 \times 15 = 75$